

CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ

૧. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૩/૦૮/૨૦૧૫ સુધી ઓપન રહેશે.આ દરમિયાન ઉમેદવારોએ પોતાનું નામ (સર્વિસબુક પ્રમાણે), મોબાઈલ નંબર અને ઉચ્ચ પગારધોરણ/બઢતીની ડ્યુ તારીખ લખવાની રહેશે. આ ત્રણ માહિતી પાછળથી બદલાશે નહિ. ઉપરની ત્રણ માહિતી આપવાથી ઉમેદવારોના એક એપ્લીકેશન નંબર કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવશે જે ઉમેદવારે લખી લેવાનો રહેશે. ત્યારપછીના તમામ કાર્ય માટે આ એપ્લીકેશન નંબર નો ઉપયોગ કરવાનો રહેશે.
૨. તા.૧૦/૦૮/૨૦૧૫ થી ૧૫/૦૮/૨૦૧૫ સુધીમાં ઉમેદવારે પોતાનો એપ્લીકેશન નંબર નાખીને માગેલી માહિતી એન્ટર કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેણી એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે.
૩. એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહિ.
૪. આ પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારે પોતાની અને ખાતામાં વડા/આચાર્યની સહી તથા સિક્કો(બંને જગ્યાએ) કરાવાના રહેશે.આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહિ.
૫. રજીસ્ટ્રેશન ફી રૂ.૧૦૦ (માત્ર થીયરી પરીક્ષા માટે), રૂ.૧૦૦ (માત્ર પ્રેક્ટીકલ પરીક્ષા માટે), રૂ.૨૦૦ (થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષા માટે) છે. જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે. ક્રેડીટકાર્ડ / ડેબીટકાર્ડ / ઈન્ટરનેટ બેન્કિંગ માટે બ્રાંચ નામ માં SBI લખવાનું રહેશે.
૬. પ્રિન્ટેડ રજીસ્ટ્રેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો નહિ હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાવી, કોસ સહી કરવાની રહેશે. તથા સ્કેન કરેલ ફોટો પોતાના એપ્લીકેશન નંબરની સાથે ccc@gtu.ac.in પર મોકલવાની રહેશે. ફોટો સ્પષ્ટ દેખાતો હોય તો પછી થી બદલવો નહિ.
૭. રજીસ્ટ્રેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્ર માં નામ સરખું હોવું જરૂરી છે.જો નામ માં તફાવત હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહિ.
૮. GTUમા જમા કરવાના ડોક્યુમેન્ટ્સ નીચે મુજબના હોવા જોઈએ.
 - A. ઓરીજનલ રજીસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટઆઉટ ઉમેદવાર ની સહી તથા HOD ની સહી અને સિક્કા સાથે.
 - B. ઓરીજનલ બેંક ચલણ કોપી (ડીપોસીટર કોપી)
 - C. ઓળખપત્ર ની નકલ (હાલની સર્વિસનું ઓળખપત્ર)
૯. ઉમેદવારે પોતાની એપ્લીકેશન દર્શાવેલ પુરાવા સાથે GTU માં વ્યક્તિગત આવીને અથવા પોસ્ટ થી નીચેના સરનામાં પર તા.૨૦/૦૮/૨૦૧૫ (જાહેર રજના દિવસો સિવાય) સુધીમાં પહોચાડવાના રહેશે.

રજીસ્ટ્રાર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
વિશ્વકર્મા સરકારી કોલેજ ની પાસે,
વિસત ત્રણ રસ્તા ની પાસે,
સાબરમતી કોબા હાઈવે,
યાંદાખેડા – અમદાવાદ. ૩૮૨૪૨૪.

૧૦. તા.૨૦/૦૮/૨૦૧૫ પછી એપ્લીકેશન સ્વીકારવામાં આવશે નહિ.
૧૧. પોસ્ટમાં થતા વિલંબ માટે GTU જવાબદાર રહેશે નહિ.
૧૨. એપ્લીકેશન ફોર્મ ની પૂછપરછ માટે 07923267616 પર સંપર્ક કરવો.
૧૩. રોજના અંદાજત ૨૦૦ પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
૧૪. દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન લાયસન્સ,આધારકાર્ડ,પાસપોર્ટ,ઈલેકશનકાર્ડ અથવા પાનકાર્ડ (આ બધામાંથી કોઈ એક) ફરજિયાત લાવવાનું રહેશે.
